



બ્રેમ્પટનના 2022 મ્યુનિસિપલ અને સ્કૂલ બોર્ડ ઇલેક્શન માટે ઉમેદવારોની ઔપચારિક યાદી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓગસ્ટ 23, 2022) – બ્રેમ્પટનના 2022 મ્યુનિસિપલ અને સ્કૂલ બોર્ડ ઇલેક્શન માટે નોમિનેશન્સ (નામાંકનો) ગયા અઠવાડિયે શુક્રવાર, ઓગસ્ટ 19 નાં રોજ બંધ થયા હતા.

સીટી ક્લાર્ક પ્રમાણિત કર્યા મુજબની, ઔપચારિક ઉમેદવારોની યાદી, [સીટીની વેબસાઇટ www.brampton.ca/bramptonvotes](http://www.brampton.ca/bramptonvotes) પર ઉપલબ્ધ છે.

જયજયકાર સાથે ચૂંટાયેલ

મ્યુનિસિપલ ઇલેક્શન્સ એક્ટ, 1996, વર્ણવે છે કે, જો, નોમિનેશન દિવસ પછીના સોમવારે બપોરે 4 વાગ્યા સુધીમાં, ઓફિસ માટે પ્રમાણિત ઉમેદવારોની સંખ્યા ચૂંટવાની સંખ્યા જેટલી સરખી કે ઓછી હોય તો, ક્લાર્ક જયજયકાર દ્વારા ઉમેદવાર કે ઉમેદવારોની ઘોષણા તાત્કાલિક કરશે. માત્ર એક નોમિનેશન, ઓફિસ ઓફ ટ્રસ્ટી, વાયમોન્ડે (Viamonde) સ્કૂલ બોર્ડને મળ્યું છે. આ જયજયકારથી ચૂંટાયેલ ય્વોન રોશેફોર્ટ (Yvon Rochefort) ને સફળ ઉમેદવાર બનાવે છે.

ઝાંખીઓ

- 2022 મ્યુનિસિપલ અને સ્કૂલ બોર્ડનું ઇલેક્શન સોમવાર, ઓક્ટોબર 24 નાં રોજ યોજાશે. મતદાન માટેનો સમય સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધીનો છે.
- મતદાન સ્થળની માહિતી સપ્ટેમ્બરમાં સીટીની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
- જો તમે ઓક્ટોબર 24 નાં રોજ મતદાન ના કરી શકો તો, ઓક્ટોબર 7, 8, 9, 14 કે 15 નાં એડવાન્સ વોટિંગ દિવસોમાંથી કોઈપણ દિવસ વિચારી શકો છો. એડવાન્સમાં મતદાનની માહિતી સપ્ટેમ્બરમાં સીટીની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. એડવાન્સ વોટિંગ દિવાળી અને બંદી છોર દિવસ ઉજવવામાં વ્યસ્ત હોઈ શકતા સામુદાયિક સભ્યો માટે એક સારો વિકલ્પ પણ છે, જે આ વર્ષે મતદાનના દિવસે આવે છે.
- પ્રોક્સી વોટિંગ (પ્રતિનિધિ દ્વારા મતદાન): જો તમે મતદાનના દિવસે અથવા એડવાન્સ વોટિંગના દિવસોમાં મત ના આપી શકતા પાત્ર બ્રેમ્પટન મતદાતા હો તો, તમે તમારા વતી પાત્રતા ધરાવનાર બીજા કોઈ બ્રેમ્પટન મતદાતાને નિમી શકો. મતદાતાઓની યાદીમાં નામ ધરાવનાર અથવા મતદાતાઓની યાદીમાં નામ ઉમેર્યું હોય તેવી કોઈ વ્યક્તિ પ્રોક્સી દ્વારા મત આપી શકે. પ્રોક્સી મતદાનને લગતી વધુ માહિતી સીટીની વેબસાઇટ પર જલદી ઉપલબ્ધ થશે.
- ઘરે મતદાન સેવા (હોમ વોટિંગ સર્વિસ): પાત્રતા ધરાવતા પણ બીમારી, ઈજા કે અશક્તતાને લીધે ઘરે રહેવા મજબૂર મતદાતાઓ હોમ વોટિંગ સર્વિસનો ઉપયોગ કરીને ઓક્ટોબર 11, 12 અને 13 નાં રોજ મત આપવા અરજી કરી શકે. સીમિત એપોઈન્ટમેન્ટ્સ પાત્રતા જરૂરિયાતો ધરાવતા લોકોને ઉપલબ્ધ રહેશે. આ સર્વિસ અને એપોઈન્ટમેન્ટ પ્રક્રિયાને લગતી વધુ માહિતી સીટીની વેબસાઇટ પર જલદી ઉપલબ્ધ થશે.
- તમારું ઓળખપત્ર લાવશો: મતદાતાઓએ પોતાનું નામ અને પોતે મત આપવાને લાયક દર્શાવતો બ્રેમ્પટનનું સરનામું દેખાડતો ઓળખનો એક નમૂનો અચૂક લાવવો રહ્યો. મતદાન પહેલાં ઓળખ માટે [સ્વીકાર્ય દસ્તાવેજોની યાદી](http://www.brampton.ca/bramptonvotes) વાંચશો.



- મ્યુનિસિપલ ઈલેક્શન વર્કર બનવા અને મતદાનના દિવસે વહીવટી અને ગ્રાહક સેવા કામગીરીઓમાં સહાયતા કરવા હમણાં અરજી કરો. 2,000 થી વધારે પદો ઉપલબ્ધ છે. ચડિયાતી પસંદગી 18 કે વધારે વર્ષની ઉંમરના બ્રેમ્પટનવાસીઓની કરવામાં આવશે. આ નવી આવડતો કેળવવાની, આ શહેરના મ્યુનિસિપલ કર્મચારીગણને ઓળખવાની અને તમારા સમુદાય સાથે જોડાવાની એક મોટી તક છે.
- ત્રાહિત પક્ષ દ્વારા જાહેરાત: સંભવિત ત્રાહિત પક્ષ જાહેરાતકર્તાઓ બ્રેમ્પટનમાં જાહેરાત આપવા નોંધણી ઓક્ટોબર 21 સુધીમાં કરાવી શકે. ત્રાહિત પક્ષ દ્વારા જાહેરાત, પાત્રતા જરૂરિયાતો અને નોંધણી પ્રક્રિયા [અહીં](#) ઉપલબ્ધ છે.

2022 મ્યુનિસિપલ અને સ્કૂલ બોર્ડ ઈલેક્શન વિશે વધુ માહિતી મેળવવા, વેબસાઇટ www.brampton.ca/bramptonvotes જુઓ.

-30-

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટીકલ્ચરલ મીડિયા

multiculturalmedia@brampton.ca